



Market News

દેશની દિગ્ગજ FMCGકંપની ડાબર ઇન્ડિયાએ 30 સપ્ટેમ્બર 2022ના પુરા થયેલા નાણાકીય વર્ષ 2022-23ના પહેલા ત્રિમાસિકમાં બિઝનેસ અપડેટ 6 ઓક્ટોબરના રજૂ કરી દીધા છે.કંપનીએ કહ્યું કે આ ગાળામાં દુનિયામાં રજૂ જીયો પોલિટિકલ તણાવના કારણે કાચા માલની કિંમતોમાં વધારો થયો છે. જેનાથી કંપનીના માર્જિન પર દબાણ જોવા મળી શકે છે. બીજા ત્રિમાસિકમાં ડાબરની રેવેન્યુ ગ્રોથ સિંગલ ડિજિટમાં રહી છે. Q2અપડેટ્સમાં આ વાતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આગળ ઇનપુટ કોસ્ટમાં વધારાના કારણે માર્જિન પર પણ 1.5થી 2 ટકા સુધી દબાણ શક્ય છે. જોકે કંપનીએ નાણાકીય વર્ષ 2022ના બીજા છમાસિકમાં ઓપરેટિંગ માર્જિનમાં સુધારાની આશા વ્યક્ત કરી છે.

સપ્તાહમાં સોનું લગભગ 4% વધ્યું. જ્યારે COMEX પર સોનું \$1700ની ઉપર દેખાય છે. MCX પર સોનામાં 52000ની નજીક કારોબાર થઈ રહ્યો છે. ચાંદી લગભગ 3 મહિનાના ઉપલા સ્તરે છે. COMEX પર ચાંદી \$20ની ઉપર છે. MCX પર ચાંદી 61500 ની નજીક છે. 1 દિવસમાં MCX પર ચાંદી 1.3% વધી. US બોન્ડ યીલ્ડમાં નરમાશથી સપોર્ટ છે. ડોલર ઇન્ડેક્સમાં નરમાશથી પણ કિંમતો વધી. ભારતમાં તહેવારી સીઝનમાં માંગ વધી. ચાઇનામાં ઇકોનોમિક એક્ટિવિટીથી માંગ વધી.

Oil Prices: કાચા તેલની કિંમતો માર્ચની શરૂઆત પછીથી હજુ સુધીની સૌથી મોટી સાપ્તાહિક તેજી તરફ વધી રહી છે. ઓપેક પ્લસ (OPEC+) શિયાળા પહેલા ઉત્પાદનમાં

કમીની યોજનાની જાહેરાત પછી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

વેસ્ટ ટેક્સાસ ઈમીડિએટ ફ્યુચર્સ શુક્રવારે વધીને 89 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા. આ પ્રકારે સપ્તાહ દરમિયાન કિંમતોમાં લગભગ 12 ટકાની તેજી આવી છે.

બજેટ એરલાઇન સ્પાઇસજેટના શેરોમાં ગુરૂવારે બીએસઈ પર 10 ટકાની તેજી જોવા મળી છે. સરકારે એક દિવસ પહેલા જ તેની ઈમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ (ECLGS) માં બદલાવ કરતા એવિએશન સેક્ટર માટે લોનની સીમાને 400 કરોડ રૂપિયા વધારીને 1500 કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી.

નાણા મંત્રાલયએ કહ્યું હતું કે કોરોના મહામારીથી પ્રભાવિત થતા એવિએશન સેક્ટરને બહાર લાવવામાં મદદ કરવા માટે ECLGS સ્કીમ દ્વારા કોલેટર-ફી કરજની સીમા વધારવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ સ્પાઇસજેટના શેરોમાં આજે ઉછાળો જોવા મળ્યો.

Praj Industries ના શેર ગુરૂવાર એટલે કે આજના ઈંટ્રાડે કારોબારમાં 9 ટકાનો ઉછાળો દેખાડતા 453.65 રૂપિયાના રેકોર્ડ હાઈ પહોંચતા જોવામાં આવ્યા. તેની સાથે જ સ્ટોકના વોલ્યૂમમાં પણ ભારી વધારો જોવાને મળ્યો છે. આજના કારોબારમાં આ સ્ટોકે 20 જાન્યુઆરી 2022 ના બનેલા પોતાના છેલ્લા હાઈ 448.25 રૂપિયાના પણ પાર કરી લીધા છે.

Result Calendar

Date	Company Name
10 October 2022	TCS
11 October 2022	DELTACORP,
12 October 2022	WIPRO,HCLTECH
13 October 2022	MINDTREE,INFY
14 October 2022	BAJAJ-AUTO,SHREECEM
15 October 2022	ICICIPRULI,LTI,



Corporate Action	Company Name	Type & Percentage	Record Date	Ex-Date
BONUS	SecMark Consult	Bonus Ratio 3:2	12~10~2022	12~10~2022
BONUS	Kaarya Faciliti	Bonus Ratio 1:1	12~10~2022	12~10~2022
BONUS	Shivalik Bimeta	Bonus Ratio 1:2	13~10~2022	12~10~2022
SPLITS	Greencrest Fin	Oldfv 10 New fv 1	~~	12~10~2022
SPLITS	Nikhil Adhesive	Oldfv 10 New fv 1	~~	12~10~2022
SPLITS	Colorchips New	Oldfv 10 New fv 2	~~	12~10~2022

Nifty Spot in Last Week:-

ઉપરમાં ૧૭૪૨૮.૮૦ અને નીચામાં ૧૬૮૫૫.૫૫ નો ભાવ જોવા મળ્યો હતો.



NIFTY WEEKLY CHART



BANKNIFTY WEEKLY CHART

Nifty Spot in Upcoming Week:-

ઉપરમાં ૧૭૪૦૦ થી ૧૭૬૦૦ supply zone છે નીચામાં ૧૬૮૦૦ થી ૧૬૬૦૦ demand zone છે.

Bank Nifty in Upcoming week:-

ઉપરમાં ૩૪૦૪૦૦ થી ૪૧૦૦૦ supply zone છે નીચામાં ૩૮૬૦૦ થી ૩૭૮૦૦ demand zone છે.

Recommendation for next week

Serial No.	Stock Name Cash segment	Above / Below / Add HOLD	CMP as on 08.10.2022	Trail SL	Buy Stop loss	Sell Stop loss	Target
1	SORILINFRA(BUY)	HOLD 66	66		60		75-80
2	LANCER(BUY)	HOLD 322	322	320			375-400
3	ZOMATO(BUY)	CMP 69.55	69.55		66.40		75-80

Commodity Market

COPPER:~ ઉછાળે ૬૮૭ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૬૩૦ સુધી નો ભાવ જોવા મળે.



CRUDEOIL:- ઉછાળે ૭૮૦૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૬૭૦૦ નો ભાવ આવી શકે, ઘટાડે ૬૭૦૦ ના s1 થી ખરીદી કરી શકાય ઉપરમાં ૭૮૦૦ સુધી નો ભાવ આવી શકે.

SILVER: ઘટાડે ૫૫૦૦૦ ના s1 થી ખરીદી કરી શકાય ઉપરમાં ૬૩૦૦૦ સુધી નો ભાવ આવી શકે.



GOLD:- ઘટાડે ૫૦૧૦૦ ના s1 થી ખરીદી કરી શકાય ઉપરમાં ૫૨૬૦૦ સુધી નો ભાવ આવી શકે.



Currency Market (Cash Levels)

USDINR:- ઉછાળે ૮૨.૫૦ થી ૮૩.૦૦ ની રેન્જમાં ૮૩.૩૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૮૧.૫૦ સુધી નો ભાવ આવી શકે,ઘટાડે ૮૦.૧૫ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૮૦.૦૦ નો s1 રાખવો ઉપરમાં ૮૨.૦૦ સુધી નો ભાવ આવી શકે.



GBPINR:- ઉછાળે ૯૩.૦૦ થી ૯૩.૬૫ ની રેન્જમાં ૯૫.૧૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૮૯.૦૦ સુધી નો ભાવ આવી શકે,ઘટાડે ૮૯.૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૮૫.૯૦ નો s1 રાખવો ઉપરમાં ૯૩.૦૦ સુધી નો ભાવ આવી શકે.



EURINR:- ઉછાળે ૮૨.૨૦ થી ૮૨.૫૦ ની રેન્જમાં ૮૨.૭૫ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૭૭.૦૦ સુધી નો ભાવ આવી શકે,ઘટાડે ૭૭.૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૭૪.૮૦ નો s1 રાખવો ઉપરમાં ૮૧.૫૦ સુધી નો ભાવ આવી શકે.



JPYINR :- ઉછાળે ૬૦.૦૦ થી ૬૧.૦૦ ની રેન્જમાં ૬૧.૭૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૫૪.૦૦ સુધી નો ભાવ આવી શકે,ઘટાડે ૫૩.૦૦ થી ૫૪.૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૫૨.૦૦ નો s1 રાખવો ઉપરમાં ૬૦.૦૦ થી ૬૧.૦૦ સુધી નો ભાવ આવી શકે.

Currency CASH LEVEL	DEMAND ZONE LEVEL		CLOSE	SUPPLY ZONE LEVEL	
	D2	D1		S1	S2
USDINR	81.00	81.75	82.25	82.50	83.00
GBPINR	90.00	91.00	92.05	93.00	94.00
EURINR	79.50	80.00	80.55	81.25	82.00
JPYINR	55.00	56.00	56.75	57.50	58.00

Currency Corner

Premium / Discount (USD/ INR) Based on Forward Rates	
Duration	Premium
One month Forward	0.24
Three month Forward	0.48
Six month	1.28
One year	2.97

RBI reference Rates	
Currency	Rates
USD	81.70
GBP	92.52
Euro	80.96
100 Yen	56.53

શા માટે વૈશ્વિક સીઈઓ ભારત માટે તેજ માં છે?

ભારત વિશ્વના આર્થિક નકશા પર એક તેજસ્વી સ્થાન તરીકે યથાવત છે. તે જ સેન્ટિમેન્ટ છે જે તાજેતરમાં અગ્રણી વૈશ્વિક CEO દ્વારા પડ્યો છે. બુલિશ સેન્ટિમેન્ટ તરફ દોરી જતા કારણો શોધો. બિઝનેસ સ્ટાન્ડર્ડ્સ (4.10.22) દ્વારા પ્રકાશિત લેખ અહીં પ્રસ્તુત છે https://www.business-standard.com/podcast/economy-policy/why-are-global-ceos-bullish-about-india-122100400106_1.html

ડોઇશ બેંકના સીઈઓ ક્રિશ્ચિયન સિવિંગે તાજેતરમાં એક નાણાકીય દૈનિકને જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાનો 'ચળકતો તારો' છે, જે યુકેન યુદ્ધ, વૈશ્વિક કુગાવો અને સપ્લાય ચેઇન વિક્ષેપને કારણે એક દાયકાની અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે.

સિવિંગ ઉપરાંત, સિટીગ્રુપના CEO જેન ફેઝર અને JPMorgan CEO જેમી ડીમોને પણ વધતા ભૌગોલિક રાજકીય જોખમો વચ્ચે લાભ મેળવવાની ભારતની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો છે, ખાસ કરીને વૈશ્વિકીકરણની પેટર્નમાં તાજેતરના ફેરફારથી, જેણે પશ્ચિમી કંપનીઓને તેમની સપ્લાય ચેઇન ચીનથી દૂર લઈ લીધી છે.

IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા પણ ભારત વિશે બુલિશ દેખાયા જ્યારે તેમણે તાજેતરમાં કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા અને માથાફૂટ હોવા છતાં દેશ વૈશ્વિક અર્થતંત્રમાં 'ઉજ્જવળ સ્થાન' બની રહ્યો છે.

સપ્ટેમ્બરની શરૂઆતમાં, HSBC ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ નોએલ ક્વિને એક નાણાકીય ચેનલને જણાવ્યું હતું કે ભારત મુખ્ય વૈશ્વિક સપ્લાયર બનવા માટે સારી સ્થિતિમાં છે. તેમણે ભારતમાં આવી રહેલા નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ તરફ ધ્યાન દોર્યું અને કેવી રીતે સરકારે ઘરેલુ મોરચે રાજકીય રીતે સ્થિર વાતાવરણ બનાવ્યું છે.

GST જેવા આર્થિક સુધારાઓથી આગળ જોતાં ભારત વિશે તેજીના કારણ તરીકે, તેમને વિશ્વાસ હતો કે ભૌગોલિક રાજનીતિ પણ રમતમાં છે અને પુરવઠા શુંખલાઓમાં ફરીથી ગોઠવણને આગળ ધપાવે છે.

ભારત આજે વધુ આકર્ષક છે, પરંતુ તેના પોતાના આર્થિક પ્રદર્શનને કારણે સંપૂર્ણપણે નથી. તાજેતરમાં ફોર્બ્સ ગ્લોબલ સીઈઓ કોન્ફરન્સમાં તેમના મુખ્ય ભાષણમાં ગૌતમ અદાણીએ કદાચ શ્રેષ્ઠ રીતે સમજાવ્યું કે વૈશ્વિક સીઈઓ શા માટે ભારત વિશે બુલિશ હતા. અદાણી ગ્રૂપના ચેરમેને કહ્યું કે વૈશ્વિક અશાંતિએ ભારતની તકોને વેગ આપ્યો છે.

રાજકીય, ભૌગોલિક અને બજારના પરિપ્રેક્ષ્યમાં, તેણે ભારતને પ્રમાણમાં તેજસ્વી સ્થળોમાંનું એક બનાવી દીધું હતું. પરંતુ, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુરોપમાં બગડતી પરિસ્થિતિ, યુનાઇટેડ કિંગડમની સતત સ્લાઇડ અને ચીનની વધતી જતી અલગતા ટાંકીને "પ્રમાણમાં" શબ્દ મહત્વપૂર્ણ છે. અદાણીએ એ પણ સ્વીકાર્યું કે ભારત સંપૂર્ણથી દૂર છે. પરંતુ, તેમણે તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતની વાસ્તવિક વૃદ્ધિની શરૂઆત જ થઈ છે.

ભારત અને અન્ય અર્થતંત્રો વચ્ચે આ પુનઃ ગોઠવણ તદ્દન સ્પષ્ટ છે. ચીન, વિશ્વનું આર્થિક એન્જિન, 1990 પછી પ્રથમ વખત તેનું આર્થિક ઉત્પાદન બાકીના એશિયા કરતાં પાછળ જોવા માટે તૈયાર છે. બેઇજિંગની શૂન્ય-કોવિડ નીતિઓ દ્વારા થયેલા નુકસાનને પ્રકાશિત કરતી નવી વિશ્વ બેંકની આગાહીમાં આ જ કહેવાનું છે. તેના પ્રોપર્ટી માર્કેટમાં મંદી.

દરમિયાન, યુરોપ શિયાળાની તૈયારી કરી રહ્યું છે જે તેની સાથે ઊર્જા સંકટ લાવશે. યુકે ઉચ્ચ કુગાવાથી ઘેરાયેલું છે, જેને બેન્ક ઓફ ઈંગ્લેન્ડે મધ્યમ કરવા માટે સંઘર્ષ કર્યો છે. પછી જીવન ખર્ચની કટોકટી છે. થોડા દિવસો પહેલા, યુકેએ પણ તાજેતરના ઇતિહાસમાં તેની સૌથી નાટકીય ચલણ કટોકટી જોઈ હતી. સપ્ટેમ્બરના અંતમાં, ઇકોનોમિસ્ટ પોલમાં બહાર આવ્યું છે કે પાંચમાંથી ત્રણ અમેરિકનોને લાગે છે કે યુએસ મંદીમાં છે.

તેનો અર્થ એ નથી કે ભારતમાં બધું સારું છે. એપ્રિલ-જૂનમાં અપેક્ષા કરતાં નીચા જીડીપી વૃદ્ધિને કારણે, આરબીઆઈએ FY23 વૃદ્ધિ અનુમાનને 7.2 ટકાથી સુધારીને 7 ટકા કર્યું છે. આંતરરાષ્ટ્રીય ફૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડા છતાં FY23 માટે કુગાવાના 6.7 ટકાની આગાહી પણ જાળવી રાખવામાં આવી છે.

નાણા મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું કે કુગાવા અને બાહ્ય ક્ષેત્રના દબાણનું સંચાલન વૃદ્ધિ કરતાં અગ્રતા ધરાવે છે. એપ્રિલ-જૂનમાં ભારતની ચાલુ ખાતાની ખાધ 23.9 અબજ ડોલર હતી. આ જાન્યુઆરી-માર્ચ 2022ના 13.4 બિલિયન ડોલર કરતાં ઘણું વધારે હતું. યુકેન પર રશિયાના આક્રમણને કારણે 2022ની શરૂઆતથી ભારત તેના આયાત બિલમાં વધારાના દબાણનો સામનો કરી રહ્યું છે.

ઊંચા ઉધાર ખર્ચ વચ્ચે સતત બીજા ક્વાર્ટરમાં નવા પ્રોજેક્ટ્સ પરનો ખર્ચ પણ ધીમો પડ્યો છે. CMIE ડેટા અનુસાર, Q2FY23માં કુલ રૂ. 3.26 ટ્રિલિયનના નવા પ્રોજેક્ટ્સ હતા, જે Q1FY23માં રૂ. 4.39 ટ્રિલિયન અને Q4FY22માં રૂ. 8.46 ટ્રિલિયન કરતાં ઘણા ઓછા હતા. નવા પ્રોજેક્ટ્સ પરનો ખર્ચ વાર્ષિક ધોરણે 4.4 ટકા ઘટ્યો છે, જે Q2FY22 માં રૂ. 3.41 ટ્રિલિયન હતો.

તાજેતરની કોલમમાં, વિશ્લેષકો અભિષેક આનંદ, જોશ ફેલમેન અને અરવિંદ સુબ્રમણ્યમ શેર કરે છે કે કેવી રીતે ભારત એક તેજસ્વી સ્થાન હોવાના દાવાઓ ઉભા થાય છે. તેમના મતે, જ્યારે અર્થવ્યવસ્થા ICUમાંથી બહાર છે, તેની તબિયત નાજુક રહે છે. તેઓ નિર્દેશ કરે છે કે જીડીપીના સંદર્ભમાં, અર્થતંત્ર ત્રણ વર્ષ પહેલાંની તુલનામાં માત્ર 3.8 ટકા મોટું છે.

તેઓ દલીલ કરે છે કે જ્યારે સતત ઝડપી વૃદ્ધિ હાંસલ કરી શકાય છે, ત્યારે દેશના મેક્રો વલણને પહેલા મજબૂત બનાવવું જોઈએ. જ્યારે આનંદ, ફેલમેન અને સુબ્રમણ્યમ દલીલ કરે છે કે વૈશ્વિક CEOs તરફથી હકારાત્મક લાગણીઓ આવકાર્ય છે, ત્યારે કદાચ સાવધાની, થોડી ચિંતા પણ સમયની જરૂરિયાત છે.

--

HEAD OFFICE

B/230-231, International Trade Center, Majura Gate, Ring Road, Surat-2.(Guj.) India Ph: 0261- 40 60 750, 246 27 90
Fax : 0261-246 27 91 www.markethubonline.com E-Mail : info@markethubonline.com

IA SEBI Registration no.:INA000005333

Disclaimer :

We do not represent that information provided by us is accurate or complete and it should not be relied upon as such. The advice provided here is just for knowledge purpose only. The user assumes the entire risk of any use made or not made of this information.

INVESTMENT IN EQUITY, MUTUAL FUND, EQUITY, CURRENCY & COMMODITY DERIVATIVES IS SUBJECT TO RISK. WE ARE DISTRIBUTOR OF MUTUAL FUND.

Client should read the Risk Disclosure Document (RDD) & Do's and Don'ts issued by SEBI & relevant exchanges before investing.

MARKET~HUB